

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ-રાજકોટ

શ્રી મુનિભાઈ પટેલ વિકાસ ભવન, પો. બો. નં.-૨૩૮, જાનનગર રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧.

-: બાંધકામના વિકાસ માટેની પરવાનગી :-

પ્રકરણ ક્રમાંક : નં. ૩૩/૬૬/૩૧/માઈકી/૧૪૨૬/૧૮/૬૬૨૩ તા. ૧૬ - ૦૩ - ૨૦૧૮

શ્રી કર્ણાભાઈ બાવાભાઈ માલધારી - - - - -

નામ : ૧૦ શ્રીશૈલજીયા, સૌમ્યવર પાર્ક સાધુવાસવાહી રોડ રાજકોટ
સરનામું :

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ (સને-૧૯૭૬ નો રાષ્ટ્રપતિ અધિનિયમ નંબર-૨૭) ની કલમ-૨૬, ૨૭, ૨૮ (૧) અને ૩૪, ૪૮, પ્રમાણે બાંધકામ વિકાસ પરવાનગી, પાછળ જોગાવેલ તેમજ નીચે જોગાવેલી ખાસ શરતોને અનુસરીને મોજે : ગામ-માઈકી તાલુકો- રાજકોટ

નાં સર્વે નં.- ૧૧૧ ટી.પી.એસ.નં.- — એફ.પી. નં.- —
ના પ્લોટ નં.- (૬૮૫૭૫/૧૫૫૨૨) (૬૮૫૭૫/૧૫૫૨૨/૧૫૫૨૨) ના ક્ષેત્રફળ (ચો.મી.) ૬૪૫૩ માં
૨ હેક્ટોર હેતુ માટે તમારી હદમાં તમારા જોખમે આપવામાં આવે છે.

કામનું વર્ણન :- ૨ હેક્ટોર હેતુ માટે એક્ટ્રીકરણ + સલામતી યોગ્યતા + બાંધકામ પ્લાન. —

બાંધકામનો પ્રકાર	બાંધકામનું ઉપયોગી ક્ષેત્રફળ ચો.મી.	બાંધકામની	રીમાર્ક્સ
		સંખ્યા	
૨ હેક્ટોર નાં હેતુ માટે અમોલગમેશન/ સબ પ્લોટીંગ/ બાંધકામ પ્લાન	આ સાથે સામૈલ પત્રક પાસાં જોડી મો દરમિયાન મુજબ બાંધકામ વિસ્તૃત થીતે		

ખાસ શરતો :-

૧. નગર રચના યોજના નં. — X — ટી. પી. ઓફીસ દ્વારા અંતિમ કરતાં જે કાંઈ ફેરફાર થશે તે બંધનકર્તા રહેશે.
૨. માલિકી પુરતી જમીનના રીવાઈઝડ બાંધકામના પ્લાન ૨ હેક્ટોર હેતુ માટેનો ઉપર દર્શાવ્યા મુજબના વપરાશ માટે જ મંજૂર કરવામાં આવે છે.
૩. માલિકી પુરતી જમીનની એક્ટ્રીકરણ ફી રૂ. ૨૫૮૪/- વસુલ કરી એક્ટ્રીકરણ પણ મંજૂર કરવામાં આવેલ છે.
૪. સબ પ્લોટીંગ તથા બાંધકામ પ્લાન માટેની અરજ અન્વયે ડેવલપમેન્ટ ચાર્જના રૂ. ૩૩૦૦/- તથા રૂ. — મળી કુલ રૂ. ૩૩૦૦/- તા. ૧૨ - ૧૨ - ૨૦૧૮ થી ભરપાઈ કરેલ છે.
૫. બાંધકામ પ્લાન અન્વયે થતી સર્વિસ એમેનીટી ફી રૂ. ૧૩૨૮૩૩/- તા. ૧૮/૧૨/૨૦૧૮ થી ભરપાઈ કરેલ છે. અને પ્લોટમાં વૃક્ષો વાવવા/જાળવવા અંગેની ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટ પણ ભરપાઈ થયેલ છે.

૬. માલિકી પુરતી જમીનના સબ પ્લોટીંગ પ્લાન/બાંધકામ પ્લાન રેગ્યુલરાઇઝેશન ફી રૂા. ...૨૨,૧૫૬/-..... વસુલ કરી રેગ્યુલરાઇઝ કરી મંજૂર કરવામાં આવે છે.
૭. પ્લાનમાં દર્શાવ્યા મુજબના માર્જન છોડવાના રહેશે.
૮. અત્રેથી અપાયેલ અગાઉની તા.ની પરવાનગી હવેથી રદ થયેલ ગણાશે.
૯. નગર રચના યોજના નં. અન્વયે બેટરમેન્ટ ચાર્જ રૂા. તા. નાં રોજથી વસુલ કરેલ છે.
૩૦. માલિકીની જમીનમાં ખાળકુવો બનાવી તેમાં શૌચાલયના ગંદા પાણીનો નિકાલ કરવાનો રહેશે. તેમજ રેઇન વોટર હાવેસ્ટીંગ સીસ્ટમ બેસાડવાની રહેશે. જે અંગે અત્રેથી ખરાઇ કરવી લેવાની રહેશે.
૧૧. સ્થાનિક સંસ્થા ગ્રામ પંચાયત ની રજા ચીકી લેવાની રહેશે. જે ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવતા પહેલા અત્રે રજુ કરવાની રહેશે.
૧૨. સ્ટ્રક્ચરલ ડિઝાઇન તથા ડ્રોઇંગ, એસ.બી.સી. રીપોર્ટ અને ફોર્મ નં. - ૧૨ તમામ વિગતો સાથે અત્રે રજુ કરાયેલ છે. જેની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.
૧૩. બાંધકામ મટીરીયલ્સ ટેસ્ટીંગ રીપોર્ટ તથા બાંધકામ અંગેનો પ્રગતિ અહેવાલ સમયાંતરે અત્રે રજુ કરવાના રહેશે. સરકારશ્રીના તા. ૨૯-૫-૨૦૦૧નાં ઠરાવની તથા ત્યારબાદની વખતો વખતની જોગવાઈને આધીન બાંધકામ વિકાસ પરવાનગી મુજબ બાંધકામ કરવાનું રહેશે.
૧૪. મંજૂર થયેલ બાંધકામ વિકાસ પરવાનગી મુજબ બાંધકામ કરવાનું રહેશે. જેમાં કોઇપણ ફેરફાર કરી શકાશે નહીં. અન્યથા અત્રેથી રીવાઇઝડ વિકાસ પરવાનગી મેળવી લેવાની રહેશે.
૧૫. બાંધકામ અંગેના સ્ટ્રક્ચરલ અંગેની તમામ જવાબદારી સ્ટ્રક્ચરલ એન્જનીયરશ્રી/એન્જનીયરશ્રી તથા અરજદારશ્રીની રહેશે. જે અંગે રૂડાની કોઇ જવાબદારી રહેશે નહીં.
૧૬. જી. ડી. સી. આર. ની પ્રવર્તમાન જોગવાઈ મુજબ ફાયર સેફ્ટીની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અને તે મુજબ સમગ્ર આયોજન પણ કરવાનું રહેશે. તથા ઉદ્યોગમાંથી નિકળતા વેસ્ટના નિકાલ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. અને ઉદ્યોગમાંથી નિકળતા ગંદા પાણીના નિકાલ માટે જરૂરી વોટર ટ્રીએન્જલની વ્યવસ્થા પણ કરવાની રહેશે. મંજૂર થયેલ હેતુ સિવાય અન્ય કોઇ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં તથા ઉપયોગ કરતા પહેલા સરકારશ્રીના અન્ય વિભાગ / નિગમ બોર્ડની અન્યોની જરૂરી રહેતી તમામ મંજૂરીઓ / એન. ઓ. સી. મેળવી લેવાની જવાબદારી તમોની / માલિકની રહેશે.
૧૭. મંજૂર થયેલ હેતુ સિવાય અન્ય કોઇ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. અન્યથા અપાયેલ વિકાસ પરવાનગી આપોઆપ રદ થયેલ ગણાશે.
૧૮. મંજૂર થયેલ લે-આઉટ મુજબ સ્થળે બાત્સ હદ માપો / ક્ષેત્રફળો ની અધિકૃત ખરાઇ કરી સ્થળે મેળવી. લેવાની સમગ્ર જવાબદારી એન્જનીયરશ્રી/આર્કીટેકશ્રી તથા અરજદારશ્રીની રહેશે.
૧૯. આ સાથેની કુલ (૧) થી (૧૩) થી જણાવેલ શરતોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૨૦ - સેન પ્લોટ નં. ૬૮૫૧૭૫/૧૫૫૧૨૨/૧, સેન પ્લોટ નં. ૬૮૫૧૭૫/૧૫૫૧૨૨/૧૬ માટે લાતે નકલ રવાના પ્રતિ, નાંદિકામ અંગે ની મંજૂરી મેળવેલ નથી.

(૧) નગર રચના અધિકારીશ્રી (૨૧) નગર રચના યોજના યોજના અન્વયે આ વિષય અપાયેલ છે.


ન.ર.યો.નં.

યુનિટ નં. જુની રૂડા બિલ્ડીંગ, રાજકોટ

(૨) તલાટી કમ મંત્રીશ્રી

મોજે સહીશ્રી..... તા. ૨૧/૦૬/૨૦.....

બિડાણ :- ઉપર મુજબ



જુનીયર નગર નિયોજક
શહેરી વિકાસ સત્તામંડળ
રાજકોટ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ ધારો - ૧૯૭૬ ની કલમ - ૨૬, ૨૮ અને ૪૯ ની શરતો

૧. વિકાસ નકશા તથા નગર રચના યોજના વિસ્તારમાં જમીન આવેલ હશે તો ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ - ૨૬, ૨૮, અને ૪૯ માં જણાવ્યા પ્રમાણેનું કોઈપણ વિકાસ કામ કરતા પહેલા કામ કરતા પહેલા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની જરૂરી મંજૂરી મેળવવી જરૂરી છે. લેન્ડ રેવન્યુ કોડની કલમ - ૬૫ પ્રમાણે જમીનોની બિન ખેતી ઉપયોગ શરૂ કરતા પહેલા કલેક્ટરશ્રી અથવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અથવા સંબંધિત સક્ષમ અધિકારીશ્રીની જરૂરી પરવાનગી મેળવવી જરૂરી છે.
૨. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ - ૨૬, ૨૮, અને ૪૯ પ્રમાણે :
 ૧. (અ) વિકાસ નકશાની અને નગર યોજનાની દરખાસ્ત અને રેગ્યુલેશનોને અનુસરીને મકાન બાંધવું પડશે.
 ૨. (બ) મકાન બાંધવાની રજા, સર્વે નંબર અગર અંતિમ ખંડ અગર એવી જમીનમાં મંજૂર થયેલા લે-આઉટનાં સબ પ્લોટ જો માલિકના કબજામાં હશે તો આપવામાં આવશે.
૨. (અ) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ મુજબ વિકાસ નકશાના તથા નગર રચના યોજનાની રેગ્યુલેશનની રૂએ જે કોઈ અંકુશો તથા શરતો મુકવામાં આવ્યા હોય તેનાથી જો કોઈ નુકશાન થાય તેમ હોય તો આ નુકશાનનો કોઈ પણ બદલો માગ્યા સિવાય માલિક તે મુજબ શરતોનો અમલ કરશે.
૨. (બ) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૨૬, ૨૮, અને ૪૯ મુજબ આપેલી વિકાસ માટેની પરવાનગીમાં જે શરતો મૂકી હશે તે તમામ શરતો પણ માલિકે પાળવાની રહેશે.
૩. જો બિલ્ડીંગ પ્લોટનાં આકાર બદલવામાં આવશે તો માલિકને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ મુજબ મળી શકે તે સિવાય વિશેષ કાંઈપણ બદલો બિલ્ડીંગ પ્લોટના ભાગલા પાડવા બદલ મળી શકશે નહીં.
૪. માલિકને વિકાસ માટેની પરવાનગી આપવામાં આવી હશે તો પણ તેમણે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ મુજબ નગર રચના યોજના માટે ફાળો આપવો પડશે / બેટરમેન્ટ ચાર્જ ભરવાનો રહેશે.

૫. નગર રચના યોજના મુજબના કાળાની ગણતરીના હેતુ માટે ફક્ત ખુલ્લી જમીન એટલે કે તે જમીન ઉપર કોઈ જાતનું બાંધકામ નથી તેમ સમજીને તેને નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ લાગુ પડશે.
૬. વિકાસ પરવાનગી અંદર બતાવેલી શરતોમાંની કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો શહેરી વિકાસ સત્તામંડળ તે શરતોનો અમલ કરાવી શકશે અને શહેરી વિકાસ સત્તામંડળના તેવા કૃત્યને લીધે જે કોઈ નુકશાન, ખોટ કે હરકત માલિકને થાય તે બદલો મળી શકશે નહીં.
૭. વિકાસ નકશાના અને નગર રચના યોજના જુદા-જુદા વિસ્તારમાં જમીનો અને મકાનોના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેની વિરુદ્ધનો ઉપયોગ કરી શકશે નહીં. તેમજ રજા માગતી વખતે નકશાના દરેક ખંડના ઉપયોગ દર્શાવ્યા હશે તેથી ઉપયોગ અગાઉથી મંજૂરી લીધા સિવાય કરી શકશે નહીં.
૮. વિકાસ નકશા તથા નગર રચના રેગ્યુલેશનો હેઠળ આપવામાં આવેલ બાંધકામની પરવાનગી શહેરી વિકાસ સત્તામંડળના મંજૂરીના હુકમની તારીખથી એક વર્ષ માટે માન્ય રહેશે અને ત્યારબાદ રદ થયેલ ગણાશે.
૯. જમીનમાં દર ૮૦ ચોરસ મીટરે એક ઝાડ ઉગાડવાનું રહેશે.
૧૦. ઉપર જણાવેલી શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ - ૧૯૭૬ ની કલમ - ૮૮ પ્રમાણે ફરીયાદ કરવામાં આવશે. અને તે ભંગ તેમાં જણાવ્યા પ્રમાણે દંડને પાત્ર ગણાશે.
૧૧. સદર પરવાનગી જી. ડી. સી. આર. અન્વયે આપવામાં આવે છે. તેમજ સ્થાનિક સંસ્થા પાસેથી રજા ચીટી મેળવવાની રહેશે.
૧૨. તમારા પ્લોટની હદમાં ખાળકૂવો કરવાનો રહેશે. કે જે અત્રેથી નિરીક્ષણ કર્યાબાદ ઢાંકવાનો રહેશે.
૧૩. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ અન્ય સંબંધિત કચેરી સંસ્થા પાસેથી જરૂરી પરવાનગી NOC મેળવ્યા બાદ જ બાંધકામ કરવાનું રહેશે.

પાન નં. 2

રૂડા/રૂડા/રાજકોટ/૨૪૬/૨૮/૨૭૨૩

સી. ૨૭૧૭૦૩૧૨૬

RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY					
OWNER : SHRI KARNABHAI BAVABHAI MALDHARI (SINDHAV)			(RESIDENTIAL PURPOSE)		
VILLAGE : MAHIKA		TALUKA/DISTRICT: RAKOT			
SUR. NO.: 199		PLOT NO. : 68TO75/15TO22		SUB PLOT NO.: 68TO75/15TO22/1 TO 16	
AMALGAMATION, SUB PLOTTING & BUILDING PLAN DETAIL					
AMALGAMATION DETAIL					
SR.NO.	PLOT NO.	PLOT AREA(SQ.MT.)			
		MINIMUM FROM (AS PER DOCUMENT/CALCULATION)			
1	68 TO 75 / 15	107.2			
2	68 TO 75 / 16	107.2			
3	68 TO 75 / 17	107.2			
4	68 TO 75 / 18	134.74			
5	68 TO 75 / 19	109.37			
6	68 TO 75 / 20	96.58			
7	68 TO 75 / 21	99.6			
8	68 TO 75 / 22	102.64			
	TOTAL AMALGAMATION DETAIL	864.53			
SUB - PLOTTING DETAIL			BUILDING PLAN DETAIL		
SR.NO.	SUB PLOT NO.	SUB PLOT AREA	G.F. AREA	F.F.AREA	TOTAL BUILT UP
		(SQ.MT.)	(SQ.MT.)	(SQ.MT.)	AREA(SQ.MT.)
1	68 TO 75/ 15 TO 22 / 1	88.00	-	-	-
2	68 TO 75/ 15 TO 22 / 2	48.80	34.31	0.00	34.31
3	68 TO 75/ 15 TO 22 / 3	48.80	34.31	0.00	34.31
4	68 TO 75/ 15 TO 22 / 4	48.80	34.31	0.00	34.31
5	68 TO 75/ 15 TO 22 / 5	48.80	34.31	0.00	34.31
6	68 TO 75/ 15 TO 22 / 6	49.17	17.62	0.00	17.62
7	68 TO 75/ 15 TO 22 / 7	55.02	33.68	0.00	33.68
8	68 TO 75/ 15 TO 22 / 8	54.51	33.68	0.00	33.68
9	68 TO 75/ 15 TO 22 / 9	53.73	33.68	0.00	33.68
10	68 TO 75/ 15 TO 22 / 10	52.95	33.68	0.00	33.68
11	68 TO 75/ 15 TO 22 / 11	51.29	16.45	0.00	16.45
12	68 TO 75/ 15 TO 22 / 12	44.09	32.71	0.00	32.71
13	68 TO 75/ 15 TO 22 / 13	44.73	32.71	0.00	32.71
14	68 TO 75/ 15 TO 22 / 14	45.35	32.71	0.00	32.71
16	68 TO 75/ 15 TO 22 / 15	45.98	32.71	0	32.71
17	68 TO 75/ 15 TO 22 / 16	84.51	-	-	-
TOTAL SUB PLOTTING DETAIL		864.53			



JUNIOR TOWN PLANNER
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY
RAJKOT

JIGNESH KUNJADIA
Consulting Civil Engineer
RAJKOT. Mo. 9898846197
RUDA LIC No. E/237
RMC LIC No. E/306